

B.Com. Semester - 1 (CBCS) Examination
Oct/Nov-2025 (New Course)
ACCOUNTING - 1(ELECTIVE-1)

Time: 2:30 Hours

Marks:70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ 'P', 'Q', 'R' 2:2:1ના પ્રમાણમાં ન. નુ. વહેંચતા એક સોલિસીટર્સ પેઢીના ભાગીદારો છે. તેઓની 31-3- (૨૦) 2018ના રોજની બાકીઓ નીચે મુજબ છે.

ઉધાર બાકી	રકમ રૂ.	જમાબાકી	રકમ રૂ.
અસીલોના ખાતા	35,000	કુલ મૂડી:	
પગાર	20,000	P 1,60,000	
પુસ્તકો	17,500	Q 80,000	
દેવાદારો	56,500	R <u>40,000</u>	2,80,000
સ્ટેશનરી	3,750	કુલ ફી	2,05,000
બેંક	22,500	અસીલોના ખાતા	5,000
તાર-ટપાલ	4,500	લેણદારો	35,000
ઓફિસ મકાન	2,50,000	અસીલ પરચુરણ ખર્ચ ખાતાવહી	3,750
મોટરકાર	50,000		
ઓફિસ ખર્ચ	9,000		
ફર્નિચર	60,000		
	5,28,750		5,28,750

વધારાની માહિતી:

- 1) અસીલો વતી ચુકવેલ રૂ. 500નો સમાવેશ ઓફિસખર્ચમાં થયેલ છે.
- 2) એક અસીલ વતી પરચુરણ ખર્ચ પેટે રૂ. 2500 મળેલ તેનો સમાવેશ અસીલ એડવાન્સ ખાતામાં થયેલ છે.
- 3) મકાન, મોટરકાર, ફર્નિચર અને પુસ્તકો પર 10% ઘસારો ગણો.
- 4) મળવા બાકી ફી રૂ. 15,000 છે.
- 5) મૂડી પર 10% લેખે વ્યાજ ગણો.
- 6) વર્ષને અંતે અધુરા કામ રૂ. 7,500 છે.

તા. 31-3-2018ના રોજ પુરા થતા વર્ષના રોકડના ધોરણે વાર્ષિક હિસાબો ગણો.

અથવા

પ્રશ્ન.૧ મિ. વિશાલ ચાર્ટેડ એકાઉન્ટન્ટ છે. તેમનું 31-3-2017ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે.

ઉધાર બાકી	રકમ રૂ.	જમાબાકી	રકમ રૂ.
અસીલોના ખાતા	80,000	મૂડી	5,00,000
પગાર	60,000	મળેલ ફી	4,00,000
પુસ્તકો	50,000	અસીલોના ખાતા	25,000
દેવાદારો	20,000	બેન્ક લોન	50,000
સ્ટેશનરી	10,000	અસીલ પરચુરણ ખર્ચ ખાતાવહી	10,000

રોકડ-બેંક	50,000		
ઓફિસ વીજળી ખર્ચ	10,000		
LIC પ્રીમીયમ	20,000		
ઓફિસ મકાન	4,00,000		
મોટરકાર	1,35,000		
ઓફિસ ખર્ચા	40,000		
મેગેઝીન ખર્ચ	7,000		
પોસ્ટેજ	3,000		
ફર્નિચર	50,000		
કમ્પ્યુટર ખરીદી (1-10-2016)	50,000		
	9,85,000		9,85,000

વધારાની માહિતી:

- 1) અસીલ વતી કરેલ ખર્ચ રૂ. 3,000 ઓફિસ ખર્ચમાં ગણેલ છે.
- 2) એક અસીલ પાસેથી રૂ. 7,000 પરચુરણ ખર્ચ પેટે મળેલ તેનો સમાવેશ અસીલ એડવાન્સ ખાતામાં થયો છે.
- 3) કમ્પ્યુટર પર 10%, મકાન પર 5% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો.
- 4) મળવાની બાકી ફી રૂ. 50,000 છે.

રોકડના ધોરણે વાર્ષિક હિસાબો તૈયાર કરો.

પ્રશ્ન.૨ સચીને તા. 1-1-2015ના રોજ લક્ષ્મી ઓટો પાસેથી એક સ્કુટર ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદ્યું. કરાર કરતી વખતે રૂ. 8,900 ચુકવ્યા અને બાકીની રકમ નીચે મુજબ ત્રણ વાર્ષિક હપ્તામાં ચુકવી. (૨૦)

- (1) તા. 31-12-2015 રૂ. 11,400
- (2) તા. 31-12-2016 રૂ. 10,500
- (3) તા. 31-12-2017 રૂ. 9,600

સચીન દર વર્ષે સ્કુટર પર 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણે છે.

સચીનના ચોપડે તૈયાર કરો:

- 1) પ્રથમ વર્ષની આમનોંધ
- 2) સ્કુટર ખાતુ તેમજ લક્ષ્મીઓટોનું ખાતું જરૂરી ગણતરીઓ દર્શાવો.

અથવા

પ્રશ્ન.૨ રામે તા. 1-1-2010ના રોજ શ્યામ પાસેથી એક ચંત્ર ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદ્યું. ખરીદીની શરતો નીચે મુજબ હતી.

- (1) ચંત્રની રોકડ કિંમત રૂ. 80,000
- (2) તા. 1-1-2010ના રોજ ચુકવણી રૂ. 30,000
- (3) તા. 31-12-2010ના રોજ ચુકવણી રૂ. 25,000
- (4) તા. 31-12-2011ના રોજ ચુકવણી રૂ. 18,000
- (5) તા. 31-12-2012ના રોજ ચુકવણી રૂ. 16,500
- (6) વ્યાજનો દર વાર્ષિક 10% છે.
- (7) ઘસારો દર વર્ષે સીધી લીટી પદ્ધતિ મુજબ 10% ગણવો.

રામના ચોપડે દરેક વર્ષની આમનોંધ અને જરૂરી બધાજ ખાતાઓ તૈયાર કરો.

પ્રશ્ન.૩ એક જહાજ “રાજ લક્ષ્મી” એ તા. 1-1-2019ના રોજ સુરતથી મુંબઈની સફર શરૂ કરી અને 14-3-2019ના રોજ પાછું ફર્યું સફરની માહિતી નીચે છે. (૧૫)

વિગત	રકમ	વિગત	રકમ
નુર :- જતા	6,00,000	જહાજનું વીમા પ્રીમીયમ(ત્રિમાસિક)	22,500
વળતા	3,00,000	વપરાયેલ માલસામગ્રી	1,50,000
બંદર મંજૂરી	1,78,000	પેસેન્જર ભાડું	40,000
કપ્તાન પગાર (૨ માસનો)	21,600	ટપાલ ભાડું	23,600
વહીવટી ખર્ચ (માસિક)	9,000		
પગાર(અર્ધ વાર્ષિક)	15,000		
બળતણ (વાર્ષિક)	1,80,000		
પરચુરણ ખર્ચ	9,120		

નુરનો વીમો 1% પ્રાઈમેઝ નુર પર 2% એડ્રેસ કમિશન જતી વખતના નુર પર 4% અને વળતી વખતના નુર પર 5% લેખે ગણવાનું છે. જહાજની કિંમત(મૂળકિંમત) તા. 1-1-2019ના રોજ રૂ. 4,00,000 છે. ઘસારો મૂળકિંમત પર 10% લેખે ગણવાનો છે. મેનેજરને ચોખ્ખા નફા પર 20% કમિશન મેળવવાનો અધિકાર છે.

ઉપરની માહિતી પરથી સફરખાતું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૩ એક જહાજ ‘વિક્રમ’ તા. 1-1-2019ના રોજ પોરબંદરથી મુંબઈની સફર શરૂ કરી તા. 14-3-2019ના રોજ પરત ફર્યું માહિતી નીચે મુજબ છે.

- નુરનો વીમો 1%
- નુર પર પ્રાઈમેઝ 2%
- એડ્રેસ કમિશન જતા 4% અને વળતા 5%
- જહાજ પર ઘસારો મૂ. કી. પર 10% ગણવો અને જહાજ 1-1-2015ના રોજ ખરીદવામાં આવેલ હતું અને 1-1-2019ના રોજ ચોપડે કિંમત રૂ. 3,00,000 છે. મેનેજરને ચોખ્ખા નફાના 20% કમિશન મેળવવાનો અધિકાર છે.

જતી વખતનું નુર	7,50,000
વળતી વખતનું નુર	3,75,000
બંદર પરની મંજૂરી (ભાડું)	2,22,500
કપ્તાનનો પગાર (2 માસનો)	27,000
વહિવટી ખર્ચ (માસિક)	11,000
પગાર (અર્ધ વાર્ષિક)	18,750
વહાણનું વી. પ્રી. (3 માસનું)	28,125
બળતણ (વાર્ષિક)	2,25,000
પરચુરણ ખર્ચ	11,400
વપરાયેલ માલ સામગ્રી	1,87,500
પેસેન્જર ભાડું	50,000
ટપાલ ભાડું	29,500

સફર ખાતું તૈયાર કરો.

પ્રશ્ન.૪ માલસામગ્રી 'M' અંગેની આવક-જાવકની માહિતી નીચે મુજબ છે.

(૧૫)

આવક			જાવક	
તારીખ	એકમો	એકમદીઠ કિંમત	તારીખ	એકમો
માર્ચ 1	90	4	માર્ચ 12	150
માર્ચ 5	180	6	માર્ચ 20	240
માર્ચ 14	210	6	માર્ચ 29	30
માર્ચ 25	90	8		

તા. 12-3-2018 અને તા. 20-3-2018ના રોજની જાવકની કિંમત નક્કી કરવા માટે અનુક્રમે લીફો(LIFO) અને ફીફો(FIFO) પદ્ધતિ ધ્યાનમાં લેવી તથા તા. 25-3-2018ના રોજથી જાવકના મૂલ્યાંકન માટે ભારીત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવો.

માલસામાન 'M'નું સ્ટોક પત્રક તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૪ એક કંપનીના માલસામાન 'A'ની માર્ચ-2018ની વિગતો નીચે મુજબ છે.

ખરીદી: 1-3-2018 : સ્ટોક 100 એકમો, એકમદીઠ રૂ. 5 લેખે

5-3-2018 : 300 એકમો, એકમદીઠ રૂ. 6 લેખે

8-3-2018 : 500 એકમો, એકમદીઠ રૂ. 7 લેખે

12-3-2018 : 600 એકમો, એકમદીઠ રૂ. 8 લેખે

ઉત્પાદન વિભાગને પુરો પાડેલ માલ

6-3-2018 250 એકમો

10-3-2018 400 એકમો

14-3-2018 500 એકમો

ફીફો(FIFO) પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરો.

English Version

Que.1 'P', 'Q' and 'R' are partners sharing P/L in ratio of 2:2:1 in a solicitor firm. Their balance as at 31-3-2018 were at below. (20)

Debt	Rs.	Credit	Rs.
Accounts of client	35,000	Total capital:	
Salaries	20,000	P 1,60,000	
Books	17,500	Q 80,000	
Debtors	56,500	R 40,000	2,80,000
Stationery	3,750	Total fees	2,05,000
Bank	22,500	Accounts of clients	5,000
Postages	4,500	Creditors	35,000
Office building	2,50,000	Sundry exp. Ledger of clients	3,750
Motor car	50,000		
Office expenses	9,000		
Furniture	60,000		
	5,28,750		5,28,750

Additional Information:

- Rs. 500 paid for clients are included in office expenses.
- Rs. 2,500 received for clients for sundry exp. Are credited in advance account of client.
- Provide 10% despreciation on Building, Motor car, Furniture and Books.
- Fees not collected on Rs. 15,000.
- Allow to 10% interest on capital
- Unfinished work Rs. 7,500 at the end of the year.

Prepare final account on cash basis the year ending on Dt. 31-3-2018.

OR

Que.1 Following is trial balance of Mr. Vishal a C. A.as on Dt. 31-3-2017.

Balance	Dr. (Rs.)	Balance	Cr (Rs.)
Client accounts	80,000	Capital	5,00,000
Salaries	60,000	Fee received	4,00,000
Books	50,000	Client accounts	25,000
Debtors	20,000	Bank loan	50,000
Stationary	10,000	Clients ledger account for mise expenses	10,000
Cash and bank	50,000		
Office light	10,000		
LIC premium	20,000		
Office building	4,00,000		
Motor car	1,35,000		
Office expenses	40,000		
Subscription of journals	7,000		
Postages	3,000		
Furniture	50,000		
Computer purchased (1-10-2016)	50,000		
	9,85,000		9,85,000

Additional Information:

- 1) An expenditure of client for Rs. 3,000 is included in office expenses.
- 2) Client's advances included Rs. 7,000 received for their miscellanecus expenses from client.
- 3) Provide depreciation on computer 10%, on office building 5%, on furniture 5%.
- 4) Fees not collected on Rs. 50,000.

Prepare final Account on cash basis.

Que.2 Sachin purchased a scooter from Laxmi auto under hire purchase system as on 1-1-2015. He paid Rs. 8,900 on signing the contract and the rest of the amount in three annual instalment as under. (20)

- (1) Dt. 31-12-2015 Rs. 11,400
- (2) Dt. 31-12-2016 Rs. 10,500
- (3) Dt. 31-12-2017 Rs. 9,600

Sachin charged 10% P.A. depreciation on scooter by diminishing balance method.

Pass journal entries for the first year only in the books of Sachine and Prepare.

- 1) Scooter A/c
- 2) Laxmi auto A/c & show necessary calculation also

OR

Que.2 Shri Ram purchased a machine on a hire purchase system from Shyam on Dt-1-1-2010.

The conditions were as below.

- (1) Cash price Rs. 80,000
- (2) Paid on 1-1-2010 Rs. 30,000
- (3) Paid on 31-12-2010 Rs. 25,000
- (4) Paid on 31-12-2011 Rs. 18,000
- (5) Paid on 31-12-2012 Rs. 16,500
- (6) The rate of interest per annum 10%.
- (7) Charged 10% depreciation P.A. on cash price (on straight line method)

Write journal entries and all necessary A/c in the books of Shri Ram.

Que.3 A ship 'Raj laxmi' commenced its voyage on 1-1-2019 from Surat to Bombay and returned on 14-3-2019. Details are below. (15)

Particulars	Rs.	Particulars	Rs.
Freight : Outward	6,00,000	Premium of ship Insurance	
Inward	3,00,000	(for three months)	22,500
Wages on port	1,78,000	Material used	1,50,000
Captain's salary (for two months)	21,600	Passage money	40,000
Admi. Exp. (Monthly)	9,000	Mail money	23,600
Salaries (Half yearly)	15,000		

Fuel (Yearly)	1,80,000	
Sundry expenses	9,120	

Additional Details:

Freight insurance 1% primage 2% on freight address commission is 4% on outward freight and 5% on inward freight. Book value of ship(face value) as on dt. 1-1-2019 was Rs. 4,00,000 depreciations is to be calculated at 10% on original cost. The manager has right to get commission at 20% on net profit.

From above information prepare voyage Account.

OR

Que.3 A ship 'Vikram' commenced its voyage on 1-1-2019 from Porbandar to Mumbai and returned on 14-3-2019.

Details of the voyage are as under:

- Freight insurance 1%
- Primage of fright 2%
- Address commission on outward 4% and inward 5%
- Depreciation on ship at 10% on original cost ship was purchased on 1-1-2015 abd the book value of ship as on 1-1-2019 was Rs. 3,00,000.
- The manager of ship has right to get commission at 20% on net profit.

Fright from outward journey	7,50,000
Fright from inward journey	3,75,000
Wages on port	2,22,500
Captain's salary (for two months)	27,000
Administrative exp. (monthly)	11,000
Salaries (Half yearly)	18,750
Premium of ship insurance (3 months)	28,125
Fuel (yearly)	2,25,000
Sundry expenses	11,400
Material used	1,87,500
Passage money	50,000
Mail money	29,000

Prepare Voyage Account

Que.4 The following is a summary of a receipts and issues of a company of material 'M'. (15)

Receipt			Issue	
Date	Units	Price per unit	Date	Units
March 1	90	4	March 12	150
March 5	180	6	March 20	240
March 14	210	6	March 29	30
March 25	90	8		

The material issued on 12-3-2018 and 20-3-2018 were priced on LIFO and FIFO basis respectively. It was decided to price the issues by weighted average method from the date 25-3-2018.

Prepare stock register for material.

OR

Que.4 One company provides detail regarding material 'A' for the March-2018.

Purchases:

- 1-3-2018: stock 100 units, Rs. 5 per unit
- 5-3-2018: 300 units, per unit Rs.6
- 8-3-2018: 500 units, per unit Rs.7
- 12-3-2018: 600 units, per unit Rs. 8

Material issued to production department:

- 6-3-2018 :250 units
- 10-3-2018: 400 units
- 14-3-2018: 500 units

Prepare stock register as per "FIFO" method.
